



## રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે બિન શૈક્ષણિક સંવર્ગની માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા થનાર કરાર આધારિત નિમણુંક માટેની સામાન્ય શરતો

- (૧) તમામ બિન શૈક્ષણિક સંવર્ગ માટે નિયત કરેલ લાયકાતના ધોરણો અનુસાર જ ઉમેદવાર લાયકાત ધરાવતાં હોવા જોઈએ. આ ઉપરાંત નિયત લાયકાત ધરાવતાં ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે કોઈ દાવો કરી શકશે નહિ. વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ કામગીરીનો અનુભવ જેવા માપદંડોને ધ્યાનમાં રાખીને કેટલા ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે પાત્ર ગણવા તે નક્કી કરવાનો અબાધિત અધિકાર રક્ષા શક્તિ યુનિવર્સિટીનો રહેશે.
- (૨) તમામ બિન શૈક્ષણિક સંવર્ગના વોક-ઇન-ઇન્ટરવ્યુ દરમિયાન જાહેરાતમાં દર્શાવેલ કુલ કરાર આધારિત ભરવાપાત્ર જગ્યાઓ(સંખ્યા) પૈકી એક પણ નહિ અથવા તો રક્ષા શક્તિ યુનિવર્સિટીની જરૂરિયાત મુજબની જગ્યા ભરવાનો અબાધિત અધિકાર રક્ષા શક્તિ યુનિવર્સિટીનો રહેશે. જે બાબતે કોઇપણ પસંદગી પામેલ કે પ્રતીક્ષા યાદીના ઉમેદવાર કોઇપણ જાતનો વાંધો ઉઠાવી શકશે નહિ તેમજ દાવો પણ રજૂ કરી શકશે નહિ.
- (૩) જો કોઈ ઉમેદવાર દ્વારા કરાર આધારિત નિમણુંક માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ દબાણ કે પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે ઉમેદવારને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે અને તેવા ઉમેદવાર સામે યોગ્ય પગલાં લેવાનો રક્ષા શક્તિ યુનિવર્સિટીને અધિકાર રહેશે.
- (૪) તમામ ઉમેદવારે રક્ષા શક્તિ યુનિવર્સિટીની વેબસાઈટ [www.rsu.ac.in](http://www.rsu.ac.in) ઉપરથી સંબંધિત સંવર્ગ માટેના લાયકાતના ધોરણો તેમજ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ઉમેદવારે લાયકાતના ધોરણોને ધ્યાને રાખીને અરજી ફોર્મ યોગ્ય રીતે ભરીને તેની સાથે તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો સ્વ-પ્રમાણિત નકલ જોડી ઇન્ટરવ્યુના દિવસે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતેથી ઇન્ટરવ્યુના દિવસે અરજી ફોર્મ આપવામાં આવશે નહિ. ઉમેદવારે ઇન્ટરવ્યુના દિવસે તમામ અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજો સાથે રાખવાના રહેશે.
- (૫) વોક-ઇન ઇન્ટરવ્યુ માટે નિયત કરેલ રીપોર્ટીંગ સમય બાદ આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે પાત્ર ગણાશે નહિ. ઉમેદવારે ઇન્ટરવ્યુ માટે નિયત કરેલ સમયના એક કલાક પહેલાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, મુ.પો.લવાડ, તા. દહેગામ, જી.ગાંધીનગર ખાતે નોંધણી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુ શરૂ થયા બાદ કોઇપણ ઉમેદવારની નોંધણી કરવામાં આવશે નહિ.



# RAKSHA SHAKTI UNIVERSITY

(First Internal Security & Police University of India; UGC Recognized)

At & Post : Lavad, Tal : Dahegam, Dist.: Gandhinagar-382305.



- (૬) રક્ષા શક્તિ યુનિવર્સિટીને સદર કરાર આધારિત નિમણુંક માટે નીચે મુજબના અબાધિત અધિકાર રહેશે.
- બિન શૈક્ષણિક સંવર્ગ માટે નિયત કરેલ લાયકાતના ધોરણોમાં છૂટછાટ આપવી તેમજ તેમાં સુધારો કરવો.
  - નજીકના ભવિષ્યમાં ભરવાની થતી કરાર આધારિત જગ્યા માટે પ્રતીક્ષા યાદી રાખવી.
- (૭) તમામ બિન શૈક્ષણિક સંવર્ગ માટે નિયત કરેલ લાયકાત ઇન્ટરવ્યુના દિવસ સુધીની ગણાશે.
- (૮) વોક-ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેનાર ઉમેદવારને કોઈપણ જાતનું ભાડા-ભથ્થું રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ચુકવવામાં આવશે નહિ. ઉમેદવારે સ્વ ખર્ચે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- (૯) સમગ્ર કરાર આધારિત ભરતી પ્રક્રિયા દરમ્યાન અથવા તો નિમણુંક હુકમ આપ્યા બાદ પણ જો ભરતી પ્રક્રિયા દરમ્યાન અજાણતા થયેલ કોઈ ભુલ ધ્યાને આવશે તો સમગ્ર ભરતી પ્રક્રિયા અથવા તો નિમણુંક હુકમ રદ કરવાનો અબાધિત અધિકાર રક્ષા શક્તિ યુનિવર્સિટીનો રહેશે.
- (૧૦) સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન જો વિવાદ અથવા તો અસ્પષ્ટતા થશે તો રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ નિર્ણય આખરી અને બંધનકર્તા ગણાશે.
- (૧૧) કોઈપણ ઉમેદવારે ઇન્ટરવ્યુના પરિણામ કે ટપાલમાં થયેલ વિલંબ માટે કોઈપણ જાતનો પત્ર વ્યવહાર કરવાનો રહેશે નહિ.

**નોંધ :** સદર ભરતી પ્રક્રિયા અંગે અન્ય કોઈપણ સ્પષ્ટતા માટે [registrar@rsu.ac.in](mailto:registrar@rsu.ac.in) ઉપર ઈ-મેઈલ કરવાનો રહેશે.